

જાહેરાત ક્રમાંક: INFO/202021/1

સિનિયર સબ એડીટર, વર્ગ-૩ તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની સીધી ભરતીની

ભાગ-૨ સંયુક્ત મુખ્ય પરીક્ષાનું આખરી પરિણામ (Final Result)

ભરતી સમિતિ, માહિતી નિયામકની કચેરી, બ્લોક નં. ૧૯, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર

સિનિયર સબ એડીટર, વર્ગ-૩ની ૧૫ જગ્યાઓ તથા માહિતી મદદનીશ વર્ગ-૩ની ૬૨ જગ્યાઓની સીધી ભરતી માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: INFO/202021/1 અન્વયે ભાગ-૨ સંયુક્ત મુખ્ય પરીક્ષા તા.૦૫/૦૯/૨૦૨૧ના રોજ લેવાયેલ હતી. ભાગ-૨ સંયુક્ત મુખ્ય પરીક્ષામાં કુલ ૪૦૦ ગુણમાંથી ઉમેદવારે મેળવેલ ગુણમાં સ્પોર્ટ્સ કેટેગરીના ઉમેદવારો અને વિધવા ઉમેદવારના કિસ્સામાં ૫ % ગુણ ઉમેરીને “આખરી ગુણ (Final Marks)” નિયત કર્યા બાદ ઉમેદવારના “આખરી ગુણ (Final Marks)” ના આધારે નિયત થયેલ મેરીટ ક્રમાંક આધારે જાહેરાતમાં દર્શાવેલ કેટેગરીવાઈઝ જગ્યાઓ ધ્યાને લઈને ભરતી સમિતી દ્વારા નીચે મુજબના પત્રકો અનુસાર પરિણામ પ્રસિધ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ પરિણામના પત્રકોની સોફ્ટ કોપીની સાઈઝ ઘણી મોટી હોવાથી તેને OJAS Website ઉપર અપલોડ કરી શકાય તેમ ના હોવાથી ઉક્ત પરિણામના પત્રકોની સોફ્ટ કોપી માહિતી નિયામક કચેરીની Website ઉપર અપલોડ કરવામાં આવેલ છે. પરિણામના પત્રકોની સોફ્ટ કોપી નીચેની Link ઉપરથી જોઈ શકાશે તથા ડાઉનલોડ કરી શકાશે.

<https://gujaratinformation.gujarat.gov.in/recruitment>

- (૧) ભરતી સમિતી દ્વારા નિમણૂક માટે ભલામણ કરાયેલા કુલ ૭૭ ઉમેદવારોની યાદી પત્રક-અ મુજબ
- (૨) ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવેલા ઉમેદવારો પૈકી જેઓ સંબંધિત કેટેગરીના કટઓફ મુજબ નિમણૂક માટે પસંદગી પામ્યા નથી તેવા ઉમેદવારો તેમજ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે પસંદગી નહિ પામેલા અસફળ (Unsuccessful) રહેલા ઉમેદવારોની યાદી પત્રક-બ મુજબ
- (૩) સિનિયર સબ એડીટર/માહિતી મદદનીશની જગ્યા ઉપર નિમણૂક મેળવવાનો પોતાનો હક્ક સ્વૈચ્છિક રીતે જતો કરેલ હોય તેવા ઉમેદવારોની યાદી પત્રક-ક મુજબ
- (૪) ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવેલા ઉમેદવારો પૈકી નિયમાનુસાર જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ન હોવાથી ગેરલાયક ઠરેલા ઉમેદવારો તથા કિમીલેયર સર્ટીફિકેટ ધરાવતા ન હોવાથી ગેરલાયક ઠરેલા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારની યાદી પત્રક-ડ મુજબ
- (૫) ભાગ-૨ સંયુક્ત મુખ્ય પરીક્ષામાં એક અથવા વધુ પુસ્ત્રપત્રમાં ગેરહાજર રહેવાને કારણે આપોઆપ ગેરલાયક ઠરેલા ઉમેદવારોની યાદી પત્રક-ઈ મુજબ

સ્થળ: ગાંધીનગર

તા:૨૧/૦૫/૨૦૨૨

સભ્ય સચિવ

ભરતી સમિતિ

માહિતી નિયામકની કચેરી